



BA-5621

Seat No. _____

B. A. (Sem. V) Examination

May/June – 2014

Home Science : Paper - CC-507

(Advance Clothing & Textile)

Time : 3 Hours]

[Total Marks : 70

૧ વસ્ત્ર ઉપયોગી તંતુના ગુણધર્મો વિષે સવિસ્તર માહિતી આપો. ૧૪

અથવા

૧ કાપડની ખરીદી કરતી વખતે ગ્રાહકને ઉદ્ભવતી મુશ્કેલીઓ જણાવો તથા તેના નિવારણ માટે ગ્રાહકોએ કયા ઉપાયો કરવા જોઈએ ? જણાવો. ૧૪

૨ યાર્નના પ્રકાર જણાવી, કોઈ પણ એક પ્રકારના યાર્નની વિગતે ચર્ચા કરો. ૧૪

અથવા

૨ તાંતણામાંથી યાર્ન બનાવવાની પ્રક્રિયા વિષે સવિસ્તર માહિતી આપો. ૧૪

૩ વણાટ એટલે શું ? વણાટના પ્રકારની ચર્ચા કરો તથા ગમે તે એક વણાટના પ્રકારની માહિતી જણાવો. ૧૪

અથવા

૩ શાળના વિવિધ ભાગોની રચના અને કાર્ય આકૃતિસહ વિગતે સમજાવો. ૧૪

૪ પરિસજ્જાના પ્રકાર જણાવી, મિકેનિકલ પરિસજ્જા વિષે સવિસ્તર માહિતી આપો. ૧૪

અથવા

- ૪ રંગના પ્રકાર જણાવી, જુદાં જુદાં પ્રકારની રંગયોજના વિષે ઉદાહરણ સહિત માહિતી આપો. ૧૪
- ૫ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો : (૧૨માંથી ૭) ૧૪
- (૧) વોર્પ અને વેફ્ટ એટલે શું ?
- (૨) ફાઈબર અને ફિલામેન્ટ વિષે માહિતી આપો.
- (૩) ટૂવીસ્ટ અને સેલ્વેઝ વિષે માહિતી આપો.
- (૪) તાંતણાનું વર્ગીકરણ જણાવો.
- (૫) ઊનના તંતુના ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મો ટૂંકમાં જણાવો.
- (૬) કપાસના તંતુના ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મો ટૂંકમાં જણાવો.
- (૭) શાળના પ્રકાર જણાવો.
- (૮) જેકાર્ડ વણાટ એટલે શું ?
- (૯) ટ્રિવલ વણાટ વિષે ટૂંકી માહિતી આપો.
- (૧૦) ડિઝાઈનના સિદ્ધાંતો જણાવો.
- (૧૧) કલાના તત્ત્વો વિષે માહિતી આપો.
- (૧૨) કેમિકલ ફિનિશિસના પ્રકાર જણાવો.